



Date: 01.02.2023

To,  
The Corporate Relations Department  
BSE Limited  
PJ Towers, 25th floor, Dalal Street,  
Mumbai - 400 001

**Sub: Newspaper Publication of Postal Ballot Notice**

**Ref. RO Jewels Limited (Script Code: 543171)**

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of Notice of Postal Ballot of the Company published in the following newspapers dated on 01<sup>st</sup> February, 2023:

1. Business Standard (English)
2. Jai Hind (Gujarati)

Kindly take the information on record and oblige.

Thanking you,

Yours faithfully,

**For RO Jewels Limited**

Shah  
Shubham  
Bharatbhai

**Subham Bharatbhai Shah**

**Managing Director**


**(DIN: 08300065)**

Ground Floor, Hall Mark - 4 Complex, Haribhakti ni Pole, Opp. B D College, Shankdi Sheri, Manekchowk, Ahmedbad - 380001.

**COMPANY'S GSTIN : 24AAJCR2945R1ZP**

**COMPANY'S CIN : L74999GJ2018PLC105540**

 **+079 22144429**

 **shubhamshah@rojewels.co.in**

 **www.rojewels.in**

BANK OF MAHARASHTRA GHATLODIA BRANCH, Ahmedabad
The under mentioned persons are hereby informed that they have failed to pay off the liability in the loan accounts. Notices sent to them by Registered Post have been returned undelivered to the Bank. They are therefore requested to pay off the liability and other charges and redeem the pledged securities on or before 06.02.2023 failing which the said securities will be sold by the Bank in public auction at the cost of the borrower on 07.02.2023 at Shop No.14, 15, 16, Satya 2, Rama Park Road, Ghatodiya Ahmedabad 380016 the Banks premises at 11:00 A.M. or on any other convenient date thereafter without further notice at the absolute discretion of the Bank. Parties interested in purchase of the Gold Ornaments may participate in the auction.

PUBLIC NOTICE
To Whomsoever it May Concern
Cancellation of Letter of Authority
I, Mr. Ajitsingh C. Thakore, Managing Partner of M/s. C. K. Thakore and Sons, a partnership firm, do hereby cancel the authority given to Mr. Ravinandkishor Jaiswal on 14/06/2016, having PAN AGFPJ5359J residing at M No. 4/323 EWS Yojana-3, Avas Vikas Colony, Jhunsli, Allahabad, Uttar Pradesh-211019 to represent the partnership firm to concern Govt. authorities / departments for the purpose of executing mining / lease right in favour of M/s. C. K. Thakore and Sons for the purpose of carrying out above work stands cancelled with immediate effect and he now no longer is holding the authority to represent M/s. C. K. Thakore and Sons. So all concerns are required to take note of this and do not deal with Mr. Ravi Jaiswal in any manner and if he/she does deal with him, it would be at his own costs and has to face all liabilities including criminal liabilities.
Date : 28/01/2023,
Place:
(Mr. Ajitsingh C. Thakore)
Managing Partner of
M/s. C. K. Thakore and Sons

Piramal Finance
PIRAMAL CAPITAL & HOUSING FINANCE LTD.
(FORMERLY KNOWN AS DEWAN HOUSING FINANCE CORPORATION LIMITED)
Regd. Office Address : Unit No. 601, 6th Floor, Amli Building, Agastya Corporate Park, Kamani Junction, L.B.S. Marg, Kuria West, Mumbai - 400070
CIN: U65910MH1984PLC032639
PUBLIC NOTICE
NOTICE is hereby given to the public at large that Piramal Capital & Housing Finance Ltd (Formerly known as Dewan Housing Finance Corporation Limited) a Housing Finance Company registered with National Housing Bank (NHB), having its registered office at Unit No. 601, 6th Floor, Amli Building, Agastya Corporate Park, Kamani Junction, LBS Marg, Kuria West, Mumbai - 400070, intends to close one of its branch located at Office No.3 & 4, 3rd Floor, Shanti Aradhna, Opp. Takhteshwar Police Station, Sakharik Haat, Waghawadi Road, Bhavnagar - 364001, Gujarat, and the same shall be shifted to Office No.303-305, Shiv Prabhru Arc, Plot No.2181/A2-B-C-D-E, Wing - B, Survey No.2972/A, Ward No.7, Sheet No.317, Waghawadi Road, Krishnaganj, Bhavnagar, Gujarat, w.e.f. 15/05/2023.
The customers who are being serviced from the location which is being closed will be serviced from the new location from 15/05/2023 onward.
All the concerned persons are requested to take note of same.
Sd/- Piramal Finance
Place: Bhavnagar
Date: 01-02-2023 For Piramal Capital & Housing Finance Ltd

HERO HOUSING FINANCE LIMITED
Registered Office: 09, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057.
Branch Office: 309, Third Floor, Nishal Centre, Near Nishal Centre, Pal Road, Pal, Adajan, Surat - 395009
PUBLIC NOTICE (E-AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTY)
[UNDER RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002]
NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY MORTGAGED WITH HERO HOUSING FINANCE LIMITED (SECURED CREDITOR) UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002
Notices is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) or their legal heirs/representatives that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the possession of which has been taken by the Authorised Officer of Hero Housing Finance Limited (secured creditor), will be sold on 07-Mar-2023 (E-Auction Date) on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "WHATSOEVER THERE IS" basis for recovery of outstanding dues from below mentioned Borrowers, Co-Borrowers or Guarantors. The Reserve Price and the Earnest Money Deposit is mentioned below. The sealed envelope containing Demand Draft of EMD for participating in Public Auction shall be submitted to the Authorised Officer of Hero Housing Finance Ltd. On or before 06-Mar-2023 till 5 PM at Branch Office: 309, Third Floor, Nishal Centre, Near Nishal Centre, Pal Road, Pal, Adajan, Surat - 395009.

IDFC FIRST Bank Limited
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)
CIN : L65110TN2014PLC097792
Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai - 600031.
Tel: +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022

IDFC FIRST Bank
APPENDIX IV [Rule 8(1)]
POSSESSION NOTICE (For immovable property)
Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the Borrower/Co-Borrowers and Guarantors to repay the amount mentioned in the demand notice appended below within 60 days from the date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.
The Borrower/Co-Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrowers/ Guarantors and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this notice.

Table with 5 columns: Loan Account Number, Borrowers/Co-borrowers & Guarantors Name, Description of The Mortgaged Properties, Demand Notice (Date, Outstanding Amount), Date and Type of Possession Taken. Includes entries for Man Mohan Textiles, Rekhaben M Moradiya, H D Marble, and others.

RO JEWELS LIMITED
CIN : U74999GJ2018PLC105540
Ground Floor, Hallmark Complex, Hari Bhakti ni Pole, Opp. B.D. College, Shankdi Sheri, Manekchowk, Ahmedabad - 380001 Gujarat, India. Phone No.: 07922144429
Email: complaince@rojwells@gmail.com Website : www.rojewels.co.in
NOTICE OF POSTAL BALLOT
Notice is hereby given that pursuant to Section 110 read with Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013, ('Act') (including any statutory modification or re-enactment thereof for the time being in force), read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, ('Rules'), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Listing Regulations'), Secretarial Standard on General Meetings issued by The Institute of Company Secretaries of India ('SS-2'), each as amended, and in accordance with the requirements prescribed by the Ministry of Corporate Affairs ('MCA') for holding extraordinary general meetings / conducting postal ballot process through e-voting vide General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 02/2022 dated May 5, 2022 and 11/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporate Affairs (MCA) (hereinafter collectively referred to as 'MCA Circulars'), the approval of the members of RO Jewels Limited (the 'Company') is being sought for Stock Split / Sub-Division of Equity Shares of the Company from the face value of Rs. 10/- to face value of Rs.2/- per share and Alteration of Capital Clause of Memorandum of Association on account of Split/ Sub-Division of Equity shares of the company, through postal ballot by voting through electronic means (remote e-voting) only.
The Postal Ballot Notice, explanatory statement and e-voting instructions, have been sent by the company through electronic mode on Tuesday, 31st January, 2023 only to those Members whose e-mail addresses are registered with the Company / Depositories as on Friday, 27th January, 2023 (cut-off date). The voting rights of the members shall be in proportion to the shares held by them in paid-up equity share capital of the company as on cut-off date. Any person who is not a Member as on the cut-off date should treat this Notice for information purposes only. The Notice has also been made available on the website of the Company at http://rojwells.co.in/, website of Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of NSDL at www.evoting.nsdl.com. The Company has engaged the services of NSDL to provide remote e-voting facility. The remote e-voting shall commence from 09:00 a.m. (IST) on Wednesday, 1st February, 2023 and ends at 5:00 p.m. (IST) on Thursday, 2nd March, 2023. E-voting shall not be allowed beyond 5:00 p.m. (IST) on Thursday, 2nd March, 2023 and the e-voting module shall be disabled by NSDL and members will not be allowed to vote thereafter.
The results of the postal ballot will be announced on or before 5:00 p.m. (IST), Saturday, March 04, 2023 and will be uploaded on the website of the Company and will be communicated to Stock Exchange i.e. BSE Limited where Equity Shares of the Company are listed.
Date : 31/01/2023
Place : Ahmedabad
For RO Jewels Limited
Sd/- Shubham Bharatbhai Shah
Managing Director (DIN: 08330065)

Terms and condition: The E-auction will take place through portal https://sarfais.auctiontger.net on 07-Mar-2023 (E-Auction Date) between 2.00 PM to 3.00 PM with limited extension of 10 minutes each. 1. The prescribed Tender/ Bid Form and the terms and conditions of sale will be available with the Branch Office, 309, Third Floor, Nishal Centre, Near Nishal Centre, Pal Road, Pal, Adajan, Surat - 395009. Between 10.00 a.m. to 5.00 p.m. on any working day. 2. The immovable property shall not be sold below the Reserve Price. 3. Bid increment amount shall be Rs.10,000/- (Rupees Ten Thousand Only). 4. All the bids/lenders submitted for the purchase of the above property shall be accompanied by Earnest Money as mentioned above by way of a Demand Draft favouring the "HERO HOUSING FINANCE LTD." payable at Surat. The Demand Drafts will be return to the unsuccessful bidders after auction. 5. The highest bidder shall be declared as successful bidder provided always that he/she is legally qualified to bid and provided further that the bid amount is not less than the reserve price. It shall be the discretion of the Authorised Officer to decline/ acceptance of the highest bid when the price offered appears so clearly inadequate as to make it inadvisable to do so. 6. The prospective bidders can inspect the property on 20-Feb-2023 between 11.00 AM and 2.00 PM with prior appointment. 7. The person declared as a successful bidder shall, immediately after the declaration, deposit 25% of the amount of purchase money/ highest bid which would include EMD amount to the Authorised Officer within 24 Hrs. and in default of such deposit, the property shall forthwith be put to fresh auction/ sale by private treaty. 8. In case the initial deposit is made as above, the balance amount of the purchase money payable shall be paid by the purchaser to the Authorised Officer on or before the 15th day from the date of confirmation of the sale of the property, exclusive of such day or the 15th day be a Sunday or other holiday, then on the first office day after the 15th day. 9. In the event of default of any payment within the period mentioned above, the property shall be put to fresh auction/ sale by private treaty. The deposit including EMD shall stand forfeited by Hero Housing Finance Ltd. and the defaulting purchaser shall lose all claims to the property. 10. The above sale shall be subject to the final approval of Hero Housing Finance Ltd. 11. Details of any encumbrances, known to the HERO HOUSING FINANCE LTD, to which the property is liable, Not Known, Claims, if any, which have been put forward to the property and any other known particulars bearing on its nature and value, Not Known. 12. Interested parties are requested to verify/confirm the statutory and other dues like Sales/Property tax, Electricity dues, and society dues, from the respective departments/offices. The Company does not undertake any responsibility of payment of any dues on the part of the bidder. 13. TDS of 1%, if any, shall be payable by the highest bidder over the highest declared bid amount. The payment needs to be deposited by the highest bidder in the PAN of the company and the copy of the challans shall be submitted to the company. 14. Sale is strictly subject to the terms and conditions incorporated in this advertisement and in the prescribed tender form. 15. The successful bidder/purchaser shall bear all stamp duty, registration fees, and incidental expenses for getting sale certificate registered as applicable as per law. 16. The Authorised Officer has the absolute right to accept or reject the bid or adjourn / postpone / cancel the tender without assigning any reason therefor and also to modify any terms and conditions of this sale without any prior notice. 17. Interested bidders may contact Mr. Kunal Dinesh Daglia at Mob. No. 9865346588 during office hours (10:00AM to 6:00 PM) or mail on assetsdisposal@hero.hf.com by mentioning the account no. of property/borrower. 18. For any other details or for procedure online training on e-auction the prospective bidders may contact the Service Provider, M/s e-Procurement Technologies Limited (Auctiontger), Mob: 9173252727 & Phone : 079-88136842. Email ID: Maulik.shrimali@auctiontger.net & support@auctiontger.net. Please send your query on WhatsApp Number-9173528727
30 DAYS SALE NOTICE TO THE BORROWER/GUARANTOR/MORTGAGOR
The above mentioned Borrower/Mortgagor/guarantors are hereby notified to pay the sum as mentioned in Demand Notice under section 13(2) with an as on date interest and expenses before the date of Auction failing which the property shall be auctioned and balance dues, if any, will be recovered with interest and cost from you.
For detailed terms and conditions of the sale, please refer to the link provided in https://uat.herohousingfinance.in/hero\_housing/other-notice on Hero Housing Finance Limited (Secured Creditor's) website i.e. www.herohousingfinance.com
For Hero Housing Finance Ltd.
Authorised officer
Mr. Kunal Dinesh Daglia, Mob: 9865346588
Email: assetsdisposal@hero.hf.com
Date: 01 Feb 2023
Place: Surat

ICICI Bank
PUBLIC NOTICE - TENDER CU-AUCTION FOR SALE OF SECURED ASSET
(See proviso to rule 8(6))
Notice for sale of immovable assets
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis as per the brief particulars given hereunder:

Table with 5 columns: Sr. No., Name of Borrower(s) / Co-Borrowers/ Guarantors/ Loan Account No., Details of the Secured asset(s) with known encumbrances, if any, Amount Outstanding, Reserve Price Earned Money Deposit, Date and Time of Inspection, Date & Time of E-Auction. Includes entry for Dr. Prabhakaran Rajkumar Joshi.

The online e-auction will take place on the website of e-auction agency M/s NexXen Solutions Private Limited. (URL Link- https://disposalhub.com). The Mortgagee's Notice are given last chance to pay the total dues with further interest till March 09, 2023 before 04:00 PM failing which, this secured asset will be sold as per schedule. The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Limited, Heritage Chambers, 2nd Floor, Near Azad Society Cross Road, Nehrunagar, Ahmedabad-380015, or before March 09, 2023 before 03:00 PM and thereafter they need to submit their offer through the above mentioned website only on or before March 09, 2023 before 04:00 PM along with scan image of Bank acknowledged DD towards proof of payment of EMD. Kindly note, in case prospective bidder(s) are unable to submit their offer through the website then signed copy of tender documents may be submitted at ICICI Bank Limited, Heritage Chambers, 2nd Floor, Near Azad Society Cross Road, Nehrunagar, Ahmedabad-380015, on or before March 09, 2023 before 05:00 PM Earnest Money Deposit DD/PO should be from a Nationalised/Scheduled Bank in favour of "ICICI Bank Limited" payable at Ahmedabad. For any further clarifications with regards to inspection, terms and conditions of the E-auction or submission of tenders, kindly contact ICICI Bank Limited on 7573024297. Please note that Marketing agencies 1. M/s NexXen Solutions Private Limited 2. Augoe Asset Management Private Limited have also been engaged for facilitating the sale of this property. The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons. For detailed terms and conditions of the sale, please visit www.icicibank.com/n4p4s
Date : February 01, 2023
Place : Ahmedabad
Authorized Officer ICICI Bank Limited

MAS FINANCIAL SERVICES LIMITED
6, Ground Floor, Narayan Chambers, B/h. Patang Hotel, Ashram Road, Ahmedabad-380009. Contact : 079-41106500/733
POSSESSION NOTICE
(FOR IMMOVABLE PROPERTY) Rule 8(1) of Security Interest (Enforcement) Rules 2002
Whereas the undersigned being the authorized officer of the MAS Financial Services Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act - 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 12-01-2022 as on below details calling upon the Borrower/Co-borrower/Guarantor to repay the amount mentioned in the notice being within Sixty Days from the date of receipt of the said notice.
The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrower/Guarantor and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said [Act] read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002, on this 28th Day of January of the year 2023.
The Borrower/Co-borrower/Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the Property will be subject to the charge of the MAS Financial Services Ltd. as on 12-01-2022 and interest thereon.
The Borrower/Co-borrower/Guarantor attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Table with 5 columns: Borrower & Co-Borrower, Guarantor Name, Description Of The Immovable Property, Loan A/C No, Date & Amount of Demand Notice. Includes entry for M/s. Yogiraj Devlopers, Partnership firm.

पंजाब नैशनल बैंक
Circle SASTRA Centre, Surat : 1st Floor, Meghna Tower, Station Road, Surat- 395 003. Ph : 8107837148 E mail : cs8323@pnb.co.in
Date of E-Auction : 10.03.2023
Date & Time of Inspection : 09.03.2023 (Between 11.00 AM to 4.00 PM)
EMD should be deposit by E-Auction Time
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the constructive/physical/symbolic possession of which has been taken by the Authorised Officer of the Bank (Secured Creditor) will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 10.03.2023 from 11:00 AM to 04:00 PM with 10 minutes extension if necessary for recovery of its dues due to the Bank (Secured Creditor from the respective borrower (s) and guarantor (s)). The reserve price and the earnest money deposit will be as mentioned in the table below against the respective properties.

Table with 5 columns: Sr. No., Name of Branch, SCHEDULE OF THE SECURED ASSETS, A) Dt. Of Demand Notice u/s 13(2) of SARFAESI ACT 2002, A) Reserve Price (Rs. in Lacs). Includes entries for PNB DAMAN and Dhirendra Shivanarayan Dubey.

સંસદના બજેટ સત્રનો પ્રારંભ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રથમ સંબોધન

દેશમાં આજે નિડર અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખનાર સરકાર: દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હી તા.૩૧ મુર્મુને પોતાના સંબોધનમાં ઉમેર્યું કે આજે ગરીબી લટાવો ફક્ત એક સુત્ર નહીં પરંતુ તે કાર્યરત થઈ ગયું છે

દેશ આજે આઝાદીના અમૃતકાળમાંથી પંચપ્રણામની પ્રેરણા લઈને આગળ વધી રહ્યો છે અને ગુવામીના દરેક નિશાન, દરેક માનસિકતાથી મુક્તિ અપાવવા માટે મારી સરકાર નિરંતર કાર્યરત છે. એક સમયે જે રાજપથ હતો તે આજે સર્વવ્યવસ્થા બની ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રના તેમના પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે આપણી વિરાસત આપણા જીવ સાથે આપણને જોડે છે અને મારી સરકાર તેને મજબૂત બનાવવા માટે પ્રાયશ્ચિંતા આપે છે. લગભગ બે માસ ચાલનારા સંસદના બજેટ સત્રમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી



સરકાર છે. નીતી અને નિર્ણયોમાં ઈચ્છાશક્તિ દર્શાવી છે. તેઓએ સર્જક શક્તિ તથા ચીન સાથેની સરહદ પર ભારતીય સૈન્યએ આપેલા જવાબનો ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું કે મારી સરકારે કલમ ૩૭૦ની નાબુદીથી લઈ ટ્રીપલ તક્કા સહિતના મુદ્દાઓ પર આકૃષ્ટ વલણ અપનાવીને કામ કર્યું છે. દ્રૌપદી મુર્મુએ સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર એ લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે અને તેથી જ સરકારની ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ ચાલુ છે. તેઓએ પોતાના પ્રથમ પ્રવચનમાં લોકોને જે કારોનાકાળથી મક્કતમાં આપવામાં આવી રહ્યું છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આત્મનિર્ભર ભારત તેમજ

રક્ષા ક્ષિત્રમાં છ ગણા થયેલા વધારાને પૂરું આગળ ધર્યો હતો અને વિકાસની બાબતમાં પણ સરકાર ગંભીર છે તે સ્પષ્ટ કર્યું હતું. રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે ભારત હવે એ સ્થિતિમાં આવી ગયો છે તે અન્ય દેશોની સમસ્યાઓને પણ ઉકેલે છે. રાષ્ટ્રપતિના ભાષણને આજે સંસદમાં શાસક પક્ષ દ્વારા તાલીઓના ગડગડાટ અને પાટલી ધપથપાવીને વધવી લેવામાં આવ્યો હતો.

મોદી સરકારની વિવિધ ઉપલબ્ધીઓને આગળ ધરતા રાષ્ટ્રપતિ: શાસક પક્ષ દ્વારા પાટલીઓ ઘપથપાવી અભિવાદન: વિપક્ષની સાંસદોએ દબલગૌરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો

આઈએમએફનું વિશ્વ અને ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મહત્વનું નિવેદન

ભારતની અર્થવ્યવસ્થા ત્રિમાસિક ગાળામાં સૌથી ઝડપથી વિકસતી હોઈ શકે

નવી દિલ્હી, તા.૩૧ અર્થવ્યવસ્થા હોઈ શકે છે. અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૨૩માં ૫.૨ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આજે વિશ્વની અર્થવ્યવસ્થા ભારતની અર્થવ્યવસ્થા વર્તમાન ક્વાર્ટરમાં ૬.૮ ટકાના દરે વધી અને ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મહત્વનું નિવેદન આપ્યું. વિશ્વ અર્થવ્યવસ્થાના સંદર્ભમાં, આઈએમએફએ કહ્યું છે કે, વર્ષ ૨૦૨૩માં વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક વૃદ્ધિમાં ૨૦૨૪ માં ૫.૮ ટકાનો વધારો થશે. ભારતની અર્થવ્યવસ્થાના નોંધવાની સંભાવના આઈએમએફના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૩માં ૫.૨ ટકા અને ૫.૪ ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. આ પ્રથમ વખત છે કે છેલ્લા વાત કરીએ તો આ ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી

અર્થવ્યવસ્થા હોઈ શકે છે. અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૨૩માં ૫.૨ ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.

**કેનરા બેંક**  
Sahakarini Saham  
કે.નં. 8238091918 / 99244 44482

**માણિત સુસુડી EECO TOUR V 5 Seater AC**  
માણિત સુસુડી નંબર GJ01HT6345

**શ્રી ધરવણરે તેમની ઓફિસ**  
કે.નં. 02.02.2023, સાં. ૧.૦૦ વાગ્યા સુધી ઉપરોક્ત જણાવેલ શાખાને મોકલી આપવી, આડી તિથિબદ્ધ માટે ઉપરોક્ત શાખાનો તા. 05.02.2023 ના બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦ દરમિયાન સંપર્ક કરી શકાય. વેચાણ માટે સૌથી વધુ ભાવપ્રદ માન્ય તારાનો, જેમાંથી ઓફિસ આપવી રહેશે અને તમામ પાર્ટીઓને બંધબંધતી રહેશે.

**ટોરન્ટ પાવર લિમિટેડ**  
નોટીસ

આકોને સુસુડીઓ અને વિશ્વની વીજવ્યવસ્થા સતત અને સુનિશ્ચિતપૂર્વક મળતો રહે તે માટે નેટવર્ક મોડેરનિઝેશનનો આયોજન કરે છે. નીચે દર્શાવેલ સમસ્યાઓ/પોલ માઉન્ટિંગ ટ્રાન્સફોર્મરની વીજવ્યવસ્થા મેળવવા પ્રાકૃતિકનો સંચારના ૧૦૦૦ થી સંજોના ૫૦૦ કલાક દરમિયાન વીજવ્યવસ્થા બંધ થવાની શક્યતા છે. આપની પ્રવૃત્તિઓનું આયોજન તે મુજબ કરવા વિનંતી.

તા. ૦૩/૦૨/૨૦૨૩, યુક્તધર: (૧) વિદ્યોત: કાવિનગર (નિયો-સી)-સી, (૨) સેક્ટર-૧૪: સર્વે ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ-સી, (૩) વિદ્યોત: સિધ્ધાઈ એસ્ટેટ-ટી, (૪) અમરાઈવાડી: તલાવડીના છાપરા કોલ, ૧-૪-૧, (૫) ધલોજી ઈસ્ટનો કોલ, હાઈડ્રો: સર્કલ-બી-સી, (૬) ગુજરાત યુનિવર્સિટી: સેક્ટર-૧૫, (૭) ચિત્રદુર્ગ: કાવિનગર-ટી, (૮) શ્રીમદ્ કોલેજી: ૨૨૩ કોલેજી-સી. એસ્ટેટ-ટી, (૯) વિદ્યોત: કલપિતર-ડી, (૩) શ્રીમદ્ કોલેજી: ૨૨૩ કોલેજી-સી.

**RO JEWELS LIMITED**  
Ground Floor, Hallmark Complex, Han Bhakti ni Pole, Opp. B.D. College, Shankdi Sheri, Manekchowk, Ahmedabad - 380001 Gujarat, India. Phone No.: 07922144429  
Email: compliancer@rojewels.com Website : www.rojewels.com.in

**NOTICE OF POSTAL BALLOT**

Notice is hereby given that pursuant to Section 110 read with Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013, ('Act') (including any statutory modification or re-enactment thereof for the time being in force), read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, ('Rules'), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 ('SEBI Listing Regulations'), Secretarial Standard on General Meetings issued by The Institute of Company Secretaries of India ('SS-2'), each as amended, and in accordance with the requirements prescribed by the Ministry of Corporate Affairs ('MCA') for holding extraordinary general meetings / conducting postal ballot process through e-voting vide General Circular No. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 02/2022 dated May 5, 2022 and 11/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporate Affairs (MCA) (hereinafter collectively referred to as 'MCA Circulars'), the approval of the members of RO Jewels Limited ('the Company') is being sought for Split/ Sub-Division of Equity Shares of the Company from the face value of Rs. 10/- to face value of Rs.2/- per share and Alteration of Capital Clause of Memorandum of Association on account of Split/ Sub-Division of Equity shares of the company, through postal ballot by voting through electronic means (remote e-voting) only.

**જાહેર નોટીસ**

આથી અમે જાહેર નોટીસ આપી જાણ કરીએ છીએ કે, કંચનધારા એસ્ટેટ ઓનર્સ એસોસીએશન (પૂજન એપાર્ટમેન્ટ) ૧૮, મોતીનગર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ (જી. નંબર NTC/G 3652 તા. ૨૮-૧-૧૯૯૧) ના ફલેટ નંબર 302ના માલિક એ. જે. ડોંકટર, ડી.એ. ડોંકટરનો રૂપિયા ર ૫૦/- ના શેર સર્ટીફિકેટ નંબર ૧૨, શેર લેજર કોલીઓ નંબર ૨ નું અસલ શેર સર્ટીફિકેટ સરવ્યયથી પોવાઈ ગયેલ છે. જેનું ડુબીકેટ શેર સર્ટીફિકેટ આપવા બાબતે કોઈ પણ વંધો હોય તે સોસાયટીના ચેરમેન/ સેક્રેટરીને દિન-૭ (સાત)માં લેખિત જાણ કરવી.

ચેરમેન/ સેક્રેટરી કંચનધારા એસ્ટેટ ઓનર્સ એસોસીએશન (પૂજન એપાર્ટમેન્ટ), ૧૮, મોતીનગર સોસાયટી, પાલડી, અમદાવાદ-૭

Date : 31/01/2023  
Place : Ahmedabad

For RO Jewels Limited  
sd/- Shubham Bharatbhai Shah  
Managing Director (DIN: 08300065)

**ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦૦૦૬**  
ટેન્ડર નોટીસ GV/PV/1-2/2023-24

ગુજરાત વિદ્યાપીઠમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમિયાન ઉત્તરવહી અને પુરવઠા છાપાવા માટે તથા સ્ટેશનરી ખરીદ અંગે ભાવ મંગાવવામાં આવે છે. અન્ય વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

Website :- www.gujaratvidyapith.org  
and www.nprocurer.com

તા. ૦૧/૦૨/૨૦૨૩ છેલ્લી તા. ૨૧/૦૨/૨૦૨૩ ડી. કુલસચિવ

**K.Z. LEASING AND FINANCE LIMITED**  
CIN : L65910GJ1986PLC00864  
Regd. Office : Doshna Chambers, B/H, Kadwa Patidar Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014. Phone : (079) 27543200

**EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED ON 31TH DECEMBER, 2022. (Rs. In Lacs)**

Sr No.	Particulars	Quarter ended on 31/12/2022 (Unaudited)	Quarter ended on 31/12/2021 (Unaudited)	Nine Months ended on 31/12/2022 (Unaudited)
1	Total Income from Operations	61.55	88.74	154.69
2	Net Profit / (Loss) for the period (before Tax, exceptional and / or extraordinary items)	32.45	61.63	70.63
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	32.45	9.01	70.63
4	Net Profit / (Loss) for the period after tax	32.45	9.01	57.03
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax))	121.26	(5.63)	(43.39)
6	Paid-up Equity Share Capital	304.12	304.12	304.12
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	---	---	---
8	Earnings per Share (of Rs.10/- each) (for continuing & discontinued operations) - Basic and Diluted	1.07	0.30	2.32

**GUJARAT TERCE LABORATORIES LIMITED**  
Reg. Office:- 12/22, Ravi Estate, Billeshwarpora, Chhatral, Dist. Gandhinagar (Gujarat)  
Phone:- 079 - 41005079, CIN NO: L24100GJ985PLC007753  
email: gtl.factory@gmail.com website:www.gujaratterce.in

**EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON DECEMBER 31, 2022.**

Sr. No.	Particulars	[RS. IN LAKHS EXCEPT PER SHARE DETAIL]		
		Quarter ended 31.12.2022 Unaudited	Quarter ended 31.12.2021 Unaudited	Year ended 31.03.2022 Audited
1	Income			
a)	Revenue from operations (Net)	1,190.48	1,074.60	4,013.37
b)	Other income	8.43	6.97	30.60
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-0.28	55.21	74.66
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	-0.28	55.21	74.66
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	-0.28	47.71	87.23
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-0.28	47.71	87.23
6	Paid up Equity Share Capital	742.03	742.03	742.03
7	Reserves (excluding Revaluation Reserve)	-136.10	266.57	111.40
8	*Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) - 1. Basic; 2. Diluted.*		0.64	1.18

વૈશ્વિક સ્તરે કોમોડિટીના વધતા ભાવને કારણે ચાલુ ખાતાની ખાધ વધુ વધી શકે છે

દેશમાં ડીકાર્બનાઈઝેશન માટે રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી

નવી દિલ્હી, તા.૩૧ મંગળવારે સંસદમાં જરૂર કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ ૨૦૨૨-૨૩માં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે કોમોડિટીના વધતા ભાવને કારણે ચાલુ ખાતાની ખાધ વધુ વધી શકે છે. માટે તેના પર ચોપટી નજર રાખવાની જરૂર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ સપ્ટેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ વધીને જીડીપીના ૪.૪ ટકા થઈ ગઈ છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તે જીડીપીના ૨.૨ ટકા હતો. ૨૦૨૨-૨૩ માટેના આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે, રિકવરીને વેગ આપવામાં આવ્યો છે, જે મોટાભાગે સ્થાનિક માંગમાં વધારો અને મોટા પ્રમાણમાં નિકાસ દ્વારા સંચાલિત છે, જે ચાલુ ખાતાના સંતુલનના જોખમોમાં વધારો કરે છે. આવી સ્થિતિમાં ચાલુ નાણાકીય વર્ષનો વૃદ્ધિદર આગામી વર્ષ સુધી જઈ શકે તેમ હોવાથી ચાલુ ખાતાની ખાધ પર ચોપટી નજર રાખવાની જરૂર છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના ક્વાઈટમેન્ટ સંબંધિત કાર્યવાહીમાં નાણાનો અભાવ સતત સમસ્યા બની રહ્યો છે. અમે હજી સુધી મોટા પાયે ઘરેલું સ્રોતોથી અમારી બધી જરૂરિયાતોને પૂર્ણ કરી છે. હવે ખાનગી મૂડી ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, સાથે જ આ માટે સોવરેન ગ્રીન બોન્ડ્સની જેમ કામ કરે છે, સરકાર પણ કામ કરી રહી છે.

ભારતની આ પહેલ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ નોંધપાત્ર છે. દેશ વૈશ્વિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે કામ કરી રહ્યો છે. વેકવિક બજાજ તરીકે હાઈડ્રોજન એક સારો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે આને ડીકાર્બનાઈઝેશનની તક તરીકે જોવામાં આવી રહ્યું છે. જે દેશ માટે ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસનું મોટું પરિબલ બની શકે છે. તે ખાતર, રિકાઈલિંગ, મિથેનોલ, દરિયાઈ પરિવહન, લોખંડ અને સ્ટીલ તેમજ લોગ હોલ પરિવહન જેવા ક્ષેત્રોમાં ડીકાર્બનાઈઝેશન પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દેશને ઉર્જા સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માટે, ડીકાર્બનાઈઝેશન તરફ સતત કામ કરવામાં આવી રહ્યું છે અને ૪ જાન્યૂઆરી, ૨૦૨૩ ના રોજ, ૧૯૮૭૪ ક્રોડ રૂપિયાના રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રીન હાઈડ્રોજનની ડિમાન્ડ જનરેશન, યુજ અને એક્સપોર્ટની સુવિધા આપવામાં આવશે અને ૮ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ પણ લાવવામાં આવશે.

**જીએચસીએલ લિમિટેડ**

રજીસ્ટર્ડ ઓફીસ : જીએચસીએલ હાઉસ, પંજાબી હોલ સામે, નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૬. ગુજરાત. Phone : 079-26434100, Fax: 079-26423623 Email: ghclinfo@ghcl.co.in, secretarial@ghcl.co.in, Website: www.ghcl.co.in, (CIN : L24100GJ1983PLC006513)

**૩૧મી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ પુરા થયેલા ત્રિમાસિક અને નવમાસિક ગાળાના ઓડિટ વગરના અનુમાનિત નાણાકીય પરિણામો (રૂ. લાક્ષણિક)**

ક્રમ નં.	વિવરણ	પૂર્વક			સંગઠિત		
		પૂર્ણ થયેલ ત્રિમાસિક	પૂર્ણ થયેલ નવમાસિક	પૂર્ણ થયેલ ત્રિમાસિક	પૂર્ણ થયેલ ત્રિમાસિક	પૂર્ણ થયેલ નવમાસિક	પૂર્ણ થયેલ ત્રિમાસિક
		૩૧.૧૨.૨૦૨૨	૩૧.૧૨.૨૦૨૨	૩૧.૧૨.૨૦૨૧	૩૧.૧૨.૨૦૨૨	૩૧.૧૨.૨૦૨૨	૩૧.૧૨.૨૦૨૧
		ઓડિટ વગરના			ઓડિટ વગરના		
૧	ચાલુ કામગીરીમાંથી થયેલ કુલ આવક	૧,૨૮૯.૪૮	૧,૦૫૦.૦૭	૧,૦૦૯.૩૬	૧,૨૮૯.૫૬	૧,૦૫૦.૪૪	૧,૦૦૯.૩૬
૨	ચાલુ કામગીરીમાંથી થયેલ અને નાણાકીય કોટર પછીનો અપવાદરૂપ બાબતો પહેલાનો ચોખ્ખો નફો	૩૩૨.૭૫	૧,૧૯૬.૪૭	૨૦૬.૩૨	૩૩૨.૮૪	૧,૧૯૬.૪૬	૨૦૬.૩૮
૩	ચાલુ કામગીરીમાંથી થયેલ કચરેસ પહેલાનો ચોખ્ખો નફો (અપવાદરૂપ અને /અથવા અસામાન્ય બાબતો પછીનો)	૩૩૨.૭૫	૧,૧૬૩.૧૭	૨૦૬.૩૨	૩૩૨.૮૪	૧,૧૬૩.૪૪	૨૦૬.૩૮
૪	ચાલુ કામગીરીમાંથી થયેલ કચરેસ પછીનો ચોખ્ખો નફો (અપવાદરૂપ અને /અથવા અસામાન્ય બાબતો પછીનો)	૨૪૭.૫૬	૮૭૫.૨૬	૧૫૨.૬૧	૨૪૭.૬૮	૮૬૮.૬૧	૧૫૨.૬૭
૫	બંધ કામગીરીમાંથી થયેલ કચરેસ પહેલાનો ચોખ્ખો નફો	-	૨.૨૯	૧૩.૭૬	૨.૮૮	૧.૬૬	૧૩.૩૭
૬	બંધ કામગીરીમાંથી થયેલ કચરેસ પછીનો ચોખ્ખો નફો	-	૬.૪૯	૧૦.૩૪	૨.૮૮	(૦.૨૪)	૬.૬૧
૭	ચાલુ અને બંધ કામગીરીમાંથી થયેલ સમગ્રગાળાનો કુલ નફો	૨૪૭.૫૬	૮૮૧.૭૮	૧૬૩.૨૫	૨૫૦.૫૬	૮૬૮.૩૭	૧૬૨.૯૮
૮	અન્ય સમાવિષ્ટ આવક	૧.૫૧	૦.૭૪	(૧.૫૬)	૧.૩૫	૦.૦૧	(૧.૫૮)
૯	કુલ સમાવિષ્ટ આવક (કચરેસ પછીની)	૨૪૯.૦૭	૮૮૨.૫૨	૧૬૧.૬૯	૨૫૧.૯૧	૮૬૮.૩૮	૧૬૧.૪૦
૧૦	ભરપાઈ થયેલ ઈક્વિટી શેર મૂડી (દરેક શેરનું દર્શાવેલ મૂલ્ય રૂ. 10/-)	૬૫.૫૬	૬૫.૫૬	૬૫.૫૬	૬૫.૫૬	૬૫.૫૬	૬૫.૫૬
૧૧	ઓડિટ થયેલ બેલેન્સ શીટ મુજબ પુનઃમૂલ્યાંકન લંબોળ સિવાયની શેર મૂડી	-	-	-	-	-	-
૧૨	શેર ઈલ કમાણી (રૂ. 10/- ના શેર ઈલ)	લિન-વાર્ષિક			લિન-વાર્ષિક		
(ક)	મૂળભૂત - ચાલુ કામગીરીમાંથી	૨૫.૬૨	૬૧.૬૨	૧૬.૦૫	૨૫.૬૩	૬૪.૦૬	૧૬.૦૭
(ખ)	તરતીફત - ચાલુ કામગીરીમાંથી	૨૫.૬૩	૬૧.૬૫	૧૬.૦૨	૨૫.૬૪	૬૪.૧૧	૧૬.૦૨
(ગ)	મૂળભૂત - બંધ કામગીરીમાંથી	-	૦.૬૮	૧.૦૬	૦.૩૦	(૦.૦૩)	૧.૦૪
(ઘ)	તરતીફત - બંધ કામગીરીમાંથી	-	૦.૬૬	૧.૦૮	૦.૩૦	(૦.૦૩)	૧.૦૪
(ચ)	મૂળભૂત - ચાલુ અને બંધ કામગીરીમાંથી	૨૫.૬૨	૬૨.૩૦	૧૭.૧૪	૨૬.૨૩	૬૪.૦૪	૧૭.૧૧
(છ)	તરતીફત - ચાલુ અને બંધ કામગીરીમાંથી	૨૫.૬૩	૬૨.૩૫	૧૭.૧૦	૨૬.૨૪	૬૪.૦૬	૧૭.૦૬

નોંધ : ઉપરોક્ત ત્રિમાસિક / વાર્ષિક નાણાકીય પરિણામો સેબી ધારે ૨૦૧૫ ના (નોંધપાત્ર) ઠરાવ અને સ્પષ્ટતાની જરૂરીયાત) નિયમોની કલમ ૩૩ ની આવશ્યકતા અનુસાર સ્ટોક એક્સચેન્જમાં જમા કરાવેલ વિગતવાર પરિણામોની લિસ્ટિંગ અનુમાનિત જાહેરની છે. આ ત્રિમાસિક / વાર્ષિક નાણાકીય પરિણામોની વિગતવાર જાહેરની બીએસઈ લિમિટેડની વેબસાઈટ URL : www.bseindia.com/corporates, નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમિટેડની વેબસાઈટ URL : www.nseindia.com/corporates અને કંપનીની વેબસાઈટ URL : http://ghcl.co.in/investors/performance-reports/ ઉપર પણ ઉપલબ્ધ છે.

ISO 9001 ISO 14001 OHSA 18001

જીએચસીએલ લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની વતી  
આર. એસ. જાલાન  
મેનેજિંગ ડિરેક્ટર  
DIN-00121260

રમણ સોષ્ટ  
સીએફઓ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર (ફાઈનાન્સ)  
DIN-00954190